

B.Sc. (HS) Semester - 6 (CBCS) Examination**March/April -2019****ADOLESCENT RELATION AND WELL BEING(CORE)****Time: 2:00 Hours****Marks: 50****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ તરૂણાવસ્થાની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. (૧૦)
અથવા
- પ્રશ્ન-૧ તરૂણાવસ્થાના વિકાસાત્મક કાર્યો સમજાવો.
- પ્રશ્ન-૨ તરૂણાવસ્થામાં શારીરિક ફેરફારો સમજાવો. (૧૦)
અથવા
- પ્રશ્ન-૨ તરૂણાવસ્થાની મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ સમજાવો.
- પ્રશ્ન-૩ તરૂણાવસ્થામાં સામાજિક વિકાસ સમજાવો. (૧૦)
અથવા
- પ્રશ્ન-૩ યૌવન પ્રવેશનો અર્થ અને તેની લાક્ષણિકતા વિશે લખો.
- પ્રશ્ન-૪ તરૂણાવસ્થામાં ઉદ્ભવતી મુંઝવણો અને તેના કારણો સમજાવો. (૧૦)
અથવા
- પ્રશ્ન-૪ યોગ વિશે સંપૂર્ણ માહિતી આપો.
- પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૦)
(1) તરૂણાવસ્થાની સંકલ્પના
(2) યૌવન પ્રવેશની ગૌણ લાક્ષણિકતાઓ
(3) તરૂણાવસ્થામાં નિર્ણયશક્તિ
(4) સ્વઓળખ અને સ્વધારણા

English Version

- Que-1 Define Adolescent and explain its characteristic. (10)
OR
- Que-1 Explain development task of Adolescent.
- Que-2 Explain physical changes during Adolescent. (10)
OR
- Que-2 Explain the psychological response of Adolescent.
- Que-3 Explain the social development in Adolescent. (10)
OR
- Que-3 Define puberty and write about its characteristics.
- Que-4 Explain the problems face in adolescent and there reasons. (10)
OR
- Que-4 Give detail information of Yoga.
- Que-5 Write short notes. (Any Two): (10)
(1) Concept of Adolescent
(2) Secondary Characteristics in puberty.
(3) Decision power in Adolescent.
(4) Self identify and self development.
